

## ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળની જા.ક. (1) ૧૬૭/૨૦૧૮૧૯- સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (મિકેનિકલ ગ્રુપ) (2) જા.ક. ૧૭૦/૨૦૧૮૧૯- સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇલેક્ટ્રીકલ ગ્રુપ), (3) જા.ક. ૧૭૪/૨૦૧૮૧૯, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઓટોમોબાઇલ ગ્રુપ), વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ જાન્યુઆરી- ૨૦૨૦ તેમજ ડિસેમ્બર -૨૦૨૦ દરમિયાન યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ-એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની જાહેરાત - સંવર્ગવાર વિગતો - યાદી (બેઠક ક્રમાનુસાર) નીચે આપેલ લીન્ક ફાઇલ પર મૂકવામાં આવેલ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

૧. જા.ક. ૧૬૭/૨૦૧૮૧૯- સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ( મિકેનિકલ ગ્રુપ), (અહીં ક્લિક કરો)
૨. જા.ક. ૧૭૦/૨૦૧૮૧૯- સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇલેક્ટ્રીકલ ગ્રુપ), (અહીં ક્લિક કરો)
૩. જા.ક. ૧૭૪/૨૦૧૮૧૯ - સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઓટોમોબાઇલ ગ્રુપ), (અહીં ક્લિક કરો)

ઉક્ત સંવર્ગોના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના સંભવિત ઉમેદવારોની ઉક્ત યાદી સંદર્ભે ઉમેદવારોએ નીચે દર્શાવ્યા મુજબની સુચનાઓ ધ્યાને લેવાની રહેશે.

### સૂચનાઓ:-

- (૧) પ્રસ્તુત યાદીમાં, ઉમેદવારોએ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને પરીક્ષામાં મેળવેલ ગુણના મેરીટસ આધારે કેટેગરી વાઇઝ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સારૂ બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ છે.
- (૨) ઉપર દર્શાવેલ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણીને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની સંખ્યા અને જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ ભરવાની

થતી જગ્યાઓની વિગતો ધ્યાને લઈ ઉમેદવારોએ ઉક્ત બંને પરીક્ષામાં મેળવેલ એકત્રિત ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે.

- (૩) ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ આખરી પરિણામ પ્રસિદ્ધ થયેથી સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ માર્ક્સની વિગતો મંડળની વેસાઇટ પરથી જોઈ શકાશે. તેથી આખરી પરિણામ પ્રસિદ્ધ થયા પહેલાં માર્ક્સ જાણવા અંગેની કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.
- (૪) ઉમેદવાર, ઉપર દર્શાવેલ યાદીમાં પોતાના નામના સમાવેશ માત્રથી તેઓનો પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ માટેનો કોઈ હક્ક દાવો કરી શકશે નહીં.

સ્થળ: ગાંધીનગર

તારીખ: ૦૪/૦૧/૨૦૨૧

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર